

Apbml/Exch./2023-24/22 05th September, 2023

To,
Corporate Relationship Department,
BSE Limited,
P.J Towers,
Dalal Street, Fort,
Mumbai- 400 001
Company Code- 540824

To,
Corporate Relationship Department
National Stock Exchange of India Ltd.
Exchange Plaza, C-1, Block- G,
Bandra- Mumbai- 400 051
Company Code- ASTRON

Dear Sir/Madam,

Sub: Newspaper Advertisement - Information regarding 13th Annual General Meeting of the Company

Pursuant to Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and in compliance with the MCA General Circular No. 10/2022 dated December 28, 2022 read with General Circular No. 20/2020 dated 5th May, 2020, a Public Notice regarding 13th Annual General Meeting of the Company have been published by way of advertisement in the in the Indian Express, English Edition and Financial Express, Gujarati Edition, dated September 05, 2023.

Kindly take on your record.

Thanking you.

Yours Faithfully, For Astron Paper and Board Mill Limited

Hina Ronak Patel Date: 2023.09.05

18:16:46 +05'30'

Digitally signed by

Hina Ronak Patel

Company Secretary and Compliance Officer

Encl, As Above.

Reg Office: D-702, Ganesh Meridian, Opp High Court, S G Highway, Ahmedabad-380060.

Phone No: +91: 079 - 40081221 Email id: info@astronpaper.com Website: www.astronpaper.com CIN:L21090GJ2010PLC063428 noblest deed.



CHHETRI,

(POSTHUMOUS)

RAM BAHADUR

05th SEPTEMBER 2023

sacrifice of this brave-heart. On this day, he laid down his life at the altar of duty while

fighting with the terrorists. His courage and bravery would remain an abiding source of

inspiration for the force. The force will

remain eternally indebted to him for his

The Tagra Teyees family proudly remembers HAVILDAR RAM BAHADUR CHHETRI, SENA MEDAL (Posthumous) who in the true traditions of the Assam Rifles made supreme sacrifice while bravely combating terrorists in Kunthal, Doda District, (J&K) on 05 September 1994. May the Almighty grant eternal peace to his soul. His gallant action will continue to inspire us all. DEEPLY REMEMBERED BY COMMANDANT

& ALL RANKS 23 ASSAM RIFLES 'TAGRA TEYEES'

Before The Hon'ble National Company Law Tribunal Ahmedabad Bench C.P.(CAA)/37(AHM)2023

C.A.(CAA)/11(AHM)2023 In the matter of the Companies Act, 2013;

And the matter of Sections 230 to 232 and other applicable provisions of the nies Act, 2013 and rules framed thereunder;

In the matter of Scheme of Arrangement bet en Yagnesh Printing Compan Private Limited (Transferor Company No. 1) and Gyanganga Printing Industries Private Limited (Transferor Company No. 2) and Yamir Packaging Private Limited (Transferoe Company) and their respective shareholders and creditors.

YAGNESH PRINTING COMPANY PRIVATE LIMITED

(CIN: U35110GJ1991PTC016303) Acompany incorporated under the provisions of the Companies Act, 1956 having it ered office situated at 18, Charankrupa Society, SM Road, Ahmedabad 15 in the state of Gujarat..... Transferor Company No.

GYANGANGA PRINTING INDUSTRIES PRIVATE LIMITED (CIN: U22211GJ1982PTC005473)

A company incorporated under the provisions of the Companies Act, 1956 a its registered office at "Yes House", 10, Shivatik Plaza, Opp. AMA, IIM Road, Pc Ahmedabad – 380015 in the state of Gujarat..... islons of the Companies Act, 1956 and havin Transferor Company No. 2 YAMIR PACKAGING PRIVATE LIMITED

(CIN: U21010GJ1991PTC016302)

A company incorporated under the provisions of the Companies Act, 1956 and having its registered office at "Yes House", 11, Shivalik Plaza, Opp. AMA, IIM Road, Polytecnic, Ahmedabad – 380006 in the state of Gujarat..... Transferee Company .. PETITIONER COMPANIES

NOTICE OF HEARING OF THE PETITION

NOTICE OF HEARING OF THE PETITION

A Petition under Section 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013 for sanctioning the Scheme of Arrangement between Yagnesh Printing Company Private Limited (Transferor Company No. 1) and Gyanganga Printing Industries Private Limited (Transferor Company) Act and Yamir Packaging Private Limited (Transferoe Company) and their respective shareholders and creditions ("Scheme") bearing ref no. C.P.(CAA)/3T(AHM)2023 seeking sanction to the aforesaid Scheme was admitted before the Horble National Company Law Tribunal, Ahmedabed Bench ("The Horble NCLT"). The Horble NCLT vide its order dated 24" August, 2023 has now fixed hearing of the petition on 19" October, 2023.

Any person desirous of opposing the said petition should send to the petitioner's advocate at the address mentioned hereunder, grounds of opposition along with affidavit, signed by him or his advocate, with his name and address, so as to reach the petitioner's advocate not later than two days before the date fixed for the hearing of the petition by the Hon ble NCLT.

A copy of the Petition will be furnished by the Petitioner Company's Advocate to any person requiring the same on payment of the prescribed charges during the isiness hours (09.30 am to 5.00 pm) from Monday to Friday

Advocate of Petitioner Companie **Dhinal Shat**

Dated: 04th September, 2023 A/5, Safal Profitaire, Opp. Prahladnagar Garden, Place: Ahmadabad Corporate Road, Ahemdabad-380015, Gujarat



ASTRON PAPER & BOARD MILL LIMITED

Reg Office: D-702, 7th Floor Ganesh Meridian, Opp. High Court, S.G. Highway, Ahmedabad-380060 Tel: (079) 40081221, Fax: (079) 40081220 CIN: L21090GJ2010PLC063428 Web: www.astronpaper.com Mail: cs@astronpaper.co

NOTICE OF 13™ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 13th Annual General Meeting ("AGM") of the Company will be held on Friday, 29th September, 2023 at 11:00 AM through Video Conference ("VC") /Other Audio Visual Means ("OAVM") to transact the pusinesses as set out in the Notice convening the 13th AGM, in compliance with, Ministry of Corporate Affairs, vide its General Circular No. dated December 28, 2022 read together with circulars dated April 8, 2020, Circular dated April 3, 2020, Circular dated May 5, 2022, issued by the Ministry of Corporate Affairs and Securities and December 1-7, 2021 and official access may 5, 2022, issued by the williams of Collipsiae Pulains and Securities and Exchange Board of India, vide its Circular No. SEBIHO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023 read with Circular dated May 13, 2022, January 15, 2021 and May 12, 2020 (collectively referred as "Circulars") have permitted the holding of AGM through VC/OAVM, without physical presence of members at common venue. In compliance with these

including on AGM or trought VOLOWAN, without physical presence or members at common venue, in complaints with messecticulars and the relevant provisions of Companies Act, 2013 and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the AGM of the members of the company will be held through VC/OAVM. In a coordance with the aforesaid Circulars, Notice of AGM along with the Annual Report 2022-23 are being sent only be electric mode to those Members whose e-mail ids are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2022-23 will also be available on the Company's Website at www.sstronpaper.com. Website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com. National Stock Exchange India a ww.nseindia.com and the AGM notice is also available on the Website of CDSL (agency for providing the Remote E ting facility) i.e., www.evotingindia.com, Members can attend and participate in the AGM through the VC/OAVM facility by. The instructions for joining the AGM are provided in the Notice of the AGM. Members attending the meeting through

VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013. The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Saturday, 23rd September, 2023 to Friday, 29th September, 2023 (inclusive of both days) in terms of the provisions of the Act and the Listing Regulations for the purpose of the AGM.

The Company is providing remote e-voting facility ("remote e-voting") to all its members to cast their votes on al resolutions as set out in the Notice of AGM. Additionally, the Company is providing the facility of voting through e-voting

system during the AGM ("e-voting"). Detailed procedure for remote e-voting is provided in Notice of the AGM.
The remote E-voting period commences at 10.00 am IST on Tuesday, 26th September, 2023 and ends at 05.00 pm IST on The Third the Company holding shares either in physical or in Thursday, 28th September, 2023. During the period members of the Company holding shares either in physical or in dematerialised form, as on Cut-off date of Friday, 22nd September, 2023 (Cut-off Date), may cast their vote by remote evoting. No members shall be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be disabled for voting upon expiry of the aforesaid period. Once the vote on a resolution is cast by the member, the member red to change it subsequently.

Members holding shares in physical form are requested to notify/send the following to RTA of the Company A. Any change in their mailing address. B. Particulars of their bank account, pan no. & e-mail ids in case the same have not been sent earlier;

C. Members who hold shares in physical form in multiple folios in identical names are required to send the shar certificate for consolidation into single folio.
Further please note that members holding equity shares in electronic form are requested to contact to their DP with whon

hey are maintaining the demat accounts for updation in address, pan no., e-mail IDs, bank details, Bank mandate, EC

n case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an e-mail to helpdesk.evoting@ dslindia.com or call 022-23058542/43. All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Man Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M J

Marg, Lower Parel (East), Mumbai – 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022 23058642/43.

Place: Ahmedabad Date: September 05, 2023 For ASTRON PAPER AND BOARD MILL LIMITED

Hina Ronak Pate

DISHMAN CARBOGEN AMCIS LIMITED

Regd. Office: Dishman Corporate House, Iscon-Bopal Road, Ambli, Ahmedab CIN: L74900GJ2007PLC051338 Phone No.: 02717-420102/124 Dishman Carbogen Amcis

Email: grievance@imdcal.com, Website: www.imdcal.com
NOTICE OF 16* ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that in compliance with General Circular No.14/2020 dated April 8, 2020; Circular No. 17/2020 dated April 13, 2020; Circular No. 20/2020 dated May 5, 2020; Circular No. 02/2021 dated January 13, 2021; and Circular No. 20/2020 dated May 5, 2020; Circular No. 02/2021 dated January 13, 2021; and Circular No. 20/2020 dated May 5, 2020; Circular No. 02/2021 dated January 13, 2021; and Circular No. 20/2020 dated May 5, 2020; Circular No. 02/2021 dated January 13, 2021; and Circular No. 20/2020 dated May 5, 2020; Circular No. 20/2020 dated May No. 02/2022 dated May 5, 2022 and Circular No. 10/2022 dated December 28, 2022 issued by Ministry of Corporat No. 02/2022 dated May 5, 2022 and Circular No. 10/2022 dated December 28, 2022 issued by Ministry of Corporate Affairs read with Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12° May, 2020; Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2023/111 dated 15° January, 2021; Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2023/42 dated 15° May, 2022 and Circular No. SEBI/HO/CFD/P/0D-2/P/CIR/2023/4 dated 5° January, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI) ("Circulars") and in compliance with all other applicable laws, the 16° Annual General Meeting ("GAM") of the Membars of the Company will be held through Video Conferencing ("C'D)ther Audio Visual Meens ("OAVIM") on Wednesday, 27° September, 2023 at IST 15:00 hrs., to transact the Ordinary and Special Businesses, as set out in the Notice of AGM. Members can attend and participate in the AGM through VC/OAVIM facility only.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM and the Annual Report 2022-23 have been sent by electronic mode on 4º September, 2023 to those Members whose e-mail addresses are registered with the Registra & Share Transfer Agent of the Company /Depository Participants. The said Notice of AGM and Annual Report 2022-23 is also available on the Company's website at www.mbcai.com; website of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at www.msaindia.com respectively and will also available on the website of CDSL at www.msaindia.com respectively and will also available on the website of CDSL at www.evotinoindia.com.

Members holding shares in dematerialized mode and whose e-mail address are not registered are requested to register their e-mail address with their relevant Depository Participants. Members holding shares in physical mode are requested to furnish their e-mail address and mobile no by providing Form ISR - 1 available on the website of the Dampary at the link https://www.imdcal.com/investor-relations under the head "Attention to Physical Shareholders" as well as well as on the vebsite of Registrar and Share Transfer Agent ("RTA") at the link https://web.linkintime.co.in/KYC-downloads.html, to the

embers will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGN through electronic voting system. The manner of remote e-voting, to attend/participate in the AGM through VC/OVAM and e-Voting during the AGM for members holding shares in dematerialized mode, physical mode and for shareholders who red their email addresses is provided in the Notice to the AGM.

In accordance with the aforesaid Circulars and pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, members are provided with the facility to cast their vote electronically through remote e-voting on all resolutions set forth in the notice of AGM; to participate in the AGM through VC/OAVM and e-voting during the AGM. In this regard, the Company has appointed Central Depository Services (India) Limited ("CDSL") to provide the above mentioned facilities. All the Members are informed that:

- a) The voting rights shall be in proportion to the shares held by members as on Wednesday, 20° September, 2023 (being cut-off date) and shareholders holdingshares either in physical form or dematerialize form as on the cut-off (being cut-off date) and shareholders holdingshares either in physical form or dematerialize form on the cut-off date may cast their vote by remote e-voting as well as e-Voting system during the AGM. Any person who becomes a member of the Company after dispatch of the Notice of meeting and holds shares as on the cut-off date, are requested to follow the instruction mentioned under heading "INSTRUCTION FOR E-VOTING" mentioned in notice of AGM for obtaining the user ID and password, which is also available at the help section of https://www.evotingindia.com. However, if such person is already registered with CDSL/ NSDL for e-Voting, then the existing user ID and password can be used for casting their vote. can be used for casting their vote.
- The facility for e-voting system shall also be made available during the AGM to those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-Voting system during the AGM.
- 5) The Members who have east their vote by remote e-voting prior to the AGM may also attend/participate the AGA through VC/OVAM but shall not be entitled to cast their vote again.
- d) The remote e-Voting period commences on Sunday, 24th September, 2023 at 9.00 a.m. and ends on Tuesda 26* September, 2023 (05:00 p.m.) and during this period, shareholders holding shares either in physical form o dematerialize form as on the cut-off date may cast their vote by remote e-voting. The remote e-voting module shall b disabled by CDSL for voting thereafter. Once the vote on a resolution is cast by member, the member shall not b allowed to change it subsequently.
- In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and remote e-voting user manual for Members available at the help section of https://www.evotingindia.com. Contact details for grievances connected with services provided by CDSL for participating in AGM through VC/OAVM, remote e-voting & e-Voting during the AGM: Mr. Rakesh Dalvi, 25° Hoor, A Wing, Marathon Futurex, Mafattal Mills Compound, NM Joshi Marg, Lower Parel (E), Mumbal 400 013. E Mall ID helpdesk.evoting@cdslindia.com. Phone No./ Helpline No. 1800 22 55 33.

For, Dishman Carbogen Ameis Ltd.

Sd/-Shrima Dave

The Indian Express. For the Indian Intelligent.

I get the inside information and get inside the information.

Inform your opinion with investigative journalism.

♦ The Indian **EXPRESS** -IOURNALISM OF COURAGE

BCA MCA

B. SC. IT M. SC. IT

MPT

Ahmedabad

indianexpress.com



A place for all to learn and grow

By creating a welcoming learning atmosphere for students from diverse backgrounds, teachers shape the attitudes and behaviours of the next generation, fostering a society that embraces differences and celebrates diversity.

alised world bring together students from various

WHEN WETHINK

BADHARBISHNAN

TOLEARN

WE KNOW WE CEASE

cultural, ethnic, and socioeconomic backgrounds. Within this rich tapestry, teachers play a pivotal role in crement that not only acknowledges diversity but also celebrates its inherent unique strength.

The task of creating a welcoming and inclusive space where every student feels welcomed, heard, understood and valued as an individual goes beyond imparting textbook knowledge. To celebrate diversity, teachers must incorporate diverse perspectives into the curriculum to broaden students' horizons and foster an understanding of and appreciation for diversity. Additionally, celebrating various cultural observances in classrooms gives impetus to the same and underscores the importance of diversity.

Furthermore, teachers must be vigilant about addressing bias and stereotypes in the classroom. By facilitating open conversations about these topics, they help students critical-Iv analyse the media and societal narratives that shape their perceptions. This empowers students to become responsible citizens who challenge prejudice and promote inclusivity.

In an inclusive classroom, collaboration takes

work together on projects that require different skill sets and

perspectives. Collaborative activities build a sense of community, where-

stulearn from each other, rely on one

another's strengths, and develop a deeper understanding of joining forces with those from diverse backgrounds to succeed as teams in accomplishing goals.


With conflicts inevitably finding their way in any diverse environment, including an educational setting, the teachers' role is pivotal in steering the resolution of conflicts among students amicably. By demonstrating and facilitating the learning of effective communication and conflict-resolution skills, teachers empower students with the skills to navigate disagreements and build positive relationships.

The diversity of the people of any nation, especially in a country as diverse as India, finds its reflection in its various educational settings. This emphasises the role of the

ducational institutes in today's glob- centre stage. Teachers encourage students to teachers in championing the celebration of diversity and taking proactive steps in classrooms to inculcate an appreciation of diversity's strength among students, who are learning to unite forces in a world divided by differ-







Aegis : Shri Charotar Moti Sattavis Patidar Kelavani Mandal

B. Sc

M. Sc

MBA

B. Sc

M. Sc

B. Sc M. Sc GNM

B. Tech

M. Tech

B. PHARM

M. PHARM

ढिन्हप्रकाश छन्डस्ट्रीअ लिमिटेड

CIN: L24100GJ2008PLC055401 **Hind**Pŕakash रिक्टर्ड ओडिस : ३०१, हिन्हप्रकाश ढाउस ,प्लोट नं. १०/५ જીઆઈડીસી, વટવા, અમદાવાદ- ૩૮૨૪૪૫, ગુજરાત, ભારત. ટેલિફોન્ન: +૯૧-૦৬૯-૬૮૧૨७૦૦૦/૧૦, કંમેલઆઈડીઃ info@hindprakash.com; વેબસાક્ટઃ www.hindprakash.in

९५भी वार्षिङ साभान्य सलानी सूचना

કંપનીના શેરધારકો નોંધ લેશે કે કંપનીની ૧૫ મી વાર્ષિક સામાન્ય સભા વિડિયો કોન્કરન્સ (વીસી) / અન્ય ઓડિયો વિઝયુઅલમીન્સ (ઓએવીએમ) દ્વારા યોજવામાં આવશે, જે કંપની એક્ટ, ૨૦૧૩ ની જોગવાઈઓ અને કોર્પોરેટ અફેસ મંત્રાલય (એમસીએ) દ્વારા તારીખ પમી મે, ૨૦૨૦ અને ૨૮મી ડિસેમ્બર, ૨૦૨૨ એ જારી કરાયેલા સામાન્ય પરિપત્રો અને સેબીના તારીખ ૧૩મી મે, ૨૦૨૨ અને પમી જાન્યુઆરી, ૨૦૨૩ ના પરિપત્રો તથા એમસીએ અને સેબી દ્વારા આ સંદર્ભમાં જારી કરાયેલા અન્ય લાગું પડતા પરિપત્રો (સામૂહિક રીતે 'પરિપત્રો' તરીકે ઓળખાતા) ના પાલન અનુસાર, એજીએમની નોટિસમાં નિર્ધારિત કરેલ કામકાજ કરવા ના હેતુ માટે યોજાશે.

ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને, એજીએમ નોટિસની અને વાર્ષિક અહેવાલ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ ની ઇલેક્ટ્રોનિક નકલો મોકલવા માટે કપની દ્વારા નિર્ધારિત કટ-ઓફ તારીખના રોજ જેમના ઇમેઇલ આઇડી કંપની/ડિપોઝિટરી સહભાગી સાથે નોંધાયેલા છે. માત્ર તેટલા જ શેરહોલ્ડરોને મોકલવામાં આવશે.

• ઉમેટ મોડમાં શેર ધરાવતા શેરહોલ્ડરો અને જેમના ઇમેઇલ આઇડી નોંધાયેલા નથી તેઓને તેમના ડિપોઝિટરી સહભાગીઓ દ્વારા તેમના સંબંધિત ડિપોઝિટરીઝ સાથે તેમના ઇમેઈલ આઇડી અને મોબાઇલ નંબર નોંધાવવા વિનંતી છે.

● ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા શેરધારકો, વાર્ષિક અહેવાલની ઇલેક્ટ્રોનિક નકલો મેળવવા માટે તેમના ઇમેઇલ આઇડી અને મોબાઈલ નેંબર કંપની સાથે info@hindprakash.com પર અથવા તેના રજિસ્ટ્રાર અને શેરટ્રાન્સફર એજન્ટ, બિગશેર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડને bssahd@bigshareonline.com પરનોધણીકરાવવામાટેવિનંતીછે. ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા શેરધારકોને તેમની હોલ્ડિંગ્સ વહેલી તને ઉંમેટ કરાવવા માટે પણ વિનતી છે.

૧૫મી એજીએમની નોટિસ અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨-૨૩, કંપનીની વેબસાઇટ www.hindprakash.in અને સ્ટોક એક્સચેંજની વેબસાઇટ www.bseindia.com અને www.nseindia.com પર પદ્મ ઉપલબ્ધ કરવામાં આવશે.

શેરહોલ્ડરોને એજીએમની નોટિસમાં જભાવ્યા મુજબ ઇલેક્ટ્રોનિક વોટિંગની સૂચનાઓ અને પ્રક્રિયાને અનુસરીને નિધારિત કરેલ તમકાજ ઉપર, રિમોટ ઇ-વોટિંગ દ્વારા અથવા એજીએમ દરમિયાન પોતાનો મત આપવાની તક મળશે. ડીમેટ મોડમાં શેર ધરાવત ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા અને જે શેરહોલ્ડરોએ તેમના ઇમેઇલઆઇડી રજીસ્ટર કરાવ્યા નહોય તેવા શેરધારકો માટે રિમોટ ઇ વોટિંગ અથવા એજીએમ દરમિયાન ઇ-વોટિંગ કરવાની રીત એજીએમની નોટિસમાં આપવામાં આવશે.

તારીખ : ૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ સ્થળ : અમદાવાદ

હિન્દપ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વતી, સહી/- અવની પટેલ કપંની સેક્રેટરી એન્ડ કમ્પ્લાયન્સ ઓફિસર

VISHAL FABRICS LTD

VISHAL FABRICS LIMITED

(CIN: L17110GJ1985PLC008206) Regd. Office: Shanti Corporate House. Near Hira Runa Hall

Bopal - Ambli Road, Ahmedabad-380058, Gujarat Phone: +91 90999 52542; E-mail: cs.vfl@chiripalgroup.com; Website: www.vishalfabricsltd.com

NOTICE TO THE MEMBERS FOR 38™ ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the 38th Annual General Meeting ("AGM") of the Vishal Fabrics Limited (the "Company") will be convened on Friday, 29" September, 2023 at 02:00 p.m. (IST) through Video Conferencing ("VC") /Other Audio Visual Means ("OAVM") facility in compliance with the applicable provisions of the Companies Act. 2013 and Rules framed thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos, 14/2020, 17 /2020, 20/2020, 02/2021, 21 /2021, 02/2022 and 10/2022 dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January 2021, 14th December 2021, 5th May, 2022 and 28th December, 2022 respectively issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India Circular No. SEBIHO/CFD/CMD1/CIR/P/2020/79 dated 12th May, 2020, SEBI/HO/CFD/CMD2/ CIR/P/2021/11 dated 15" January, 2021, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated 13" May, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated 05" January, 2023 ("SEBI Circulars"), to transact the business as set out in the Notice convening the AGM without the physica presence of the Members at a common venue.

The Notice of the AGM and the Annual Report for the financial year 2022-23 including the Financial Statements for the year ended 31* March, 2023 (*Annual Report") will be sent only through e-mail to all those Members, whose email addresses are registered /updated with the pany or with their respective Depository Participants in accordance with the MCA Circulars and the SEBI Circulars. Members can join and participate in the AGM through VC /OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shal be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act 2013. The Notice of the AGM and the Annual Report will also be available on the website of the Company at www.vishalfabricsltd.com and the websites of stock exchange where the securities of the Company are listed i.e. BSE Limited at www.bseindia.com.

Members who have not registered their email address will be able to cast their vote electroni cally on the business as set out in the Notice of the AGM either remotely (during remot e-voting period) or during the AGM as per the manner provided in the Notice to Members.

If your email address is registered with the Company /Depository Participants the login creder tials for remote e-voting are being sent on your registered email address. Please note that same login credentials are required for participating in the AGM through VC /OAVM and voting on resolutions during the AGM.

If your email address is not registered, you are requested to get the same registered /upda by contacting their respective Depository Participants.

The above information is being issued for the information and benefit of all the Members of the

Company and is in compliance with MCA Circulars and the SEBI Circulars For, Vishal Fabrics Limited

Pooja Dhruve

Company Secretary

Date: 05/09/2023

astron®

એસ્ટ્રોન પેપર એન્ડ બોર્ડ મીલ લીમીટેડ

રજી. ઓફીસ: ડી-હન્ટર, ખ્ર્મો માળ, ગણેશ મેરીડીચન, હાઇકોર્ટ સામે, એસ.જી. હાઇવે, અમદાવાદ-૩૮૦ ૦૬૦. ફોન: (079) 40081221, ફેન્ક્સ: (079) 40081220, સીઆઇએન: L21090GJ2010PLC063428

वेजसार्वर: www.astronpaper.com भेवल: cs@astronpaper.com ९३भी पार्षिक साधारण सलानी नोहिस

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૧૩મી વાર્ષિક સાધારણ સભા શુક્રવાર તારીખ રક સપ્ટેમ્બર ૧૦૧૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વિડિચો સંગઠન (વીસી) / અન્ય ઓડિચો વિઝ્યુઝલ મિન્સ (ઓએવીએમ) દ્વારા ચોજવામાં આવશે. કોર્પોરેટ બાળતોના મંત્રાલયના અનુપાલનમાં ૧૩મી એજીએમ બોલાવતી નોટીસમાં નિર્ધારિત કરાયેલા કારોબારનો વ્યવહાર કરવા માટે, ન્ય પરિપત્ર નેળર તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૨ સાથે વંચાણમાં લેતા તારીખ ૨ એપ્રીલ ૨૦૨૦ના પરિપત્ર, તા. ૧૩ એપ્રિલ ૨૦૨૦ના પરિપઝ, તા. ૫ મે ૨૦૨૦ના પરિપઝ, તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના પરિપઝ, તા. ૮ ડોસેમ્બર ૨૦૨૧ના પરિપઝ, તા. ૧૪ ડીસેમ્બર ૨૦૨૧ના પરિપઝ અને તા. ૫ મે ૨૦૨૨ના પરિપઝ, કોર્પોરેટ અફેર્સ એન્ડ સીક્યુટીટી એન્ડ એક્સ્યેન્જ ભોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપઝ નં. સેબી/એચઓ/રીએફડી/પીઓડી-ર/સીઆઇઆસ/૨૦૨૩/૪ તારીખ પ આફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવવા પારપળ ના સાળા અધ્યમાં સાથે કર્યા આધારા અધ્યસ્થ અને ૧૨ મે વર (સાનું હિલ દીત બન્યુઆરી, સ્વરવ આને ૧૨ મે વર (સાનું હિલ દીત પાર્ટિયા) તરીકે ઉલ્લેખ) જોગવાઈઓ અનુસાર સામાન્ય સ્થળે સભ્યોની ભીતિક હાજરી વિના, વીસી/ઓએવીએમ દ્વારા એપ્રુપ્તમાં મેજૂરી આપી છે. આ પરિપત્નો અને કંપનીત્ર એક્ટ, ૨૦૧૩ અને સેબી (લિસ્ટિંગ ઓવ્દિગેશન્ય એન્ડ સિસ્ક્લોઝર દિલ્તાયરેન્ટરમું રેચ્યુલેશન્ય, ૨૦૧૫ની સંગંધિત જોગવાઇઓ અનુસાર કંપનીના સભ્યોની એપ્રુપ્તમે વીસી/ઓએવીએમ દ્વારા ચેપનીના સભ્યોની એપ્રુપ્તમે હીસી/ઓએવીએમ દ્વારા ચેપનામાં આવશે.
ઉપરોસ્ત પરિપત્ની અનુસાર, વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ સાથે એપ્રુપ્તમન નોદાસ કંપની છે. સભ્યો નોદ હવે કે એપ્રુપ્તમે અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ નોદીસ કંપની / ડિપોઝીટરીમાં નોદાસેલા છે. સભ્યો નોદ હવે કે એપ્રુપ્તમે અને વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ નોદીસ કંપનીની વેબસાઈટ www.astronpaper.com, ૨૨ીક એક્સપ્ટેન્જની વેબસાઈટ એપ્રના વિક્રિ અહેવાલ ૨૦૨૨–૨૩ નોદીસ કંપનીની વેબસાઈટ www.astronpaper.com, ૨૨ીક એક્સપ્ટેન્જની વેબસાઈટ એપ્રસ્થાન

બીએસઈ લિમીટેડની વેબસાઈટ www.bseindia.com. નેશનલ સ્ટોક એક્સરોન્જ ઈન્ડિયાની વેબસાઈટ www.nseindia.co બાગરાઇ ાલગાટડના વબસાઇટ www.useindia.com, બરાનલ સ્ટાઇક એક્શરોલ્જ ઇન્ડરોના વબસાઇટ www.useindia.com પર ઉપલબ્ધ હશે. તથા ઇ-વોરિંગનો સુવિધા પુરી પાડનાર સંસ્થા સીડીએસએલનો વેબસાઇટ www.evotingindia.com પર પા ઉપલબ્ધ છે. સભ્યો કુકત વીસી/ઓએવીએમ સુવિધા દ્વારા જ એક્ઝુએમમાં હાજરી આપી અને ભાગ લઇ શકે છે. એક્ઝુએમ એડાવા માટેની સુચનાઓ એક્ઝુએમની નોટીસમાં આપવામાં આવી છે. વીસી/ઓએવીએમ દ્વારા બેઠકમાં ભાગ લેનારા સભ્યોન્ ગણતરી કંપની દ્વારા ૨૦૧૩નો કલમ ૧૦૩ મુજબ કોરમની ગણતરીના હેતુ માટે કરવામાં આવશે.

ગ્લાદારા અપના કૃપરા વર્ષા ગાં કવન ૧૦૩ મુજન કારમના ગઇદારાના હતુ માટ કરવામા આવશ. એજીએમ હેતુ માટે અદિનિયમ અને લિસ્ટિંગ ટેચ્યુલેશન્સની સંબંધિત જોગદાઈઓ અનુસાર કંપનીના સભ્યોનું રિજસ્ટિટ અ કેર ટ્રાલ્સફ્ટ બુક શનીવાર, ૨૩ સપ્ટેંગ્ગર, ૨૦૨૩ શી શુક્રવાર, ૧૯ સપ્ટેંગ્ગર, ૨૦૨૩ (બેને દિવસો સહિત) સુધી બંધ રહેશે. કંપની એજીએમની સુચનામાં જણાવેલ તમામ 6રાવો પર પોતાના મત આપવા માટે તેના તમામ સભ્યોને રિમોટ ઇ-વોર્ટિંગ સુવિદ (રિમોટ ઇ-વોર્ટિંગ) પ્રદાન કરી રહી છે. વધુમાં કંપની એજીએમ દરમિયાન ઇ-વોર્ટિંગ સિસ્ટમ (ઇ-વોર્ટિંગ) દ્વારા મતદાન કરવાન્ સુવિદ્યા પ્રદાન કરી રહી છે. રિમોટ ઇ-વોર્ટિંગ(ઇ-વોર્ટિંગ માટેની વિગતવાર સુચના એજીએમના નિર્દિશ્યો આપવામાં આવી છે. રિમોટ ઇ-વોટિંગનો સમયગાળો મંગળવાર, રદ્દ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ (IST) વાગ્યે શરૂ થશે અને ગુરૂવાર ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે (IST) સમાપ્ત થશે. આ સયમગાળા દરમિયાન, શુક્રવાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨ (ક્રટ-ઓફ્ર તારીખ)ના રોજ ભીતિક સ્વરૂપે અથવા ડીમઢીરિયલાયઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા કંપનીના સભ્યો રિમોઢ ઈ વોટિંગ દ્વારા તેમનો મત આપી શક્શે. ઉપરોક્ત તારીખ અને સમય પછી કોઈ રીમોટ ઈ-વોટિંગને મંજૂરી આપવામાં આવશે નર્હ અને રીમોર્ડ ઇ-વોર્ટિંગ મોડ્યુલર ઉપરોક્ત સમયગાળાની સમાદિ પર મતદાન માટે અક્ષમ કરવા દ્વારા 6રાવ પર મત આપવામાં આવે, તે પછી સભ્યને તેમાં ફેસ્ફાર કરવાની મેજૂરી આપવામાં આવશે

ભૌતિક સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યોને કંપનીના આરટીએને નીચેની સૂચના/વિંગતો મોકલવા વિનંતી કરવામાં આવે છે.

ાના મેઇલ સરનામાં કોઇપણ ફેસ્ફાર

બી) તેમની બેંક ખાતાની વિગતો. પાન નંબર અને ઈ–મેઈલ આઈડી જો અગાઉ મોકલવામાં ન આવ્યા હોય તો

શી) સભ્યો કે જેઓ એક્સરખા નામોમાં બહુવિધ ફોલિયોમાં ભૌતિક રવરૂપમાં શેર ધરાવે છે તેમને સિંગલ ફોલિ એક્ઝીકરણ માટે શેર પ્રમાણપત્ર મોકલવા વિનંતી છે.

અઝગાકરતા નાત સર પ્રમાણત્ય માકવાના ભગારા છે. વધુમાં, મહેરળાની કરીને નોંધ કરો કે ઉંક્ષ્ટ્રોબિક રવરૂપમાં ઇક્લિટી શેર ધરાવતા સભ્યોને સરનાયું, પાન નંબર, ઈ-મેઇ આઈડી, બેંક વિગતો, બેંક આદેશ, ઈરીએસ આદેશ વગેરે અપડેટ કરવા માટે તેમના ડીપીનો સંપર્ક કરવા વિનંતી કરવાઃ આવે છે કે જેમની સાથે તેઓ ડીમેટ એકાઉન્ટર જાળવી રહ્યા છે.

જો તેમને ઇ-વોટિંગ સંબંધિત કોઇ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય તો તમે વારંવાર પુછાતા પ્રશ્નો (એફએક્યુએસ)નો સંદર્ભ લે અને www.evolingindia.com પર ઉપલબ્ધ ઇ-વોટિંગ મેન્યુઅલનો સંદર્ભ લો અથવા helpdesk.evoting@cdslindia.com ને ઇ-મેઇલ લખી શકો છો અથવા ૦૨૨–૨૩૦૫૮૫૪૨/૪૩ પર ફોન કરીને જાણકારી મેળવી શકો છો.

ઈલેક્ટ્રોનિક માધ્યમથી વોટીંગ માટેની સુવિધા સાથે જોડાયેલી તમામ ફરિયાદો શ્રી ટાફેશ દ્વવી, મેનેજર, સેન્ટ્રલ ડિપોઝીટર ઇનલર્ટ્સાઇ નાહ્યના વાટિંગ નાર્ટના સુધાના દાવા ના કાર્યાલના ભાગના સ્વારાટના સાથે કાર્યા હયા. નગગર, લગ્ફા કાર્યાદ સર્વિસીસ (ઇન્ડિયા) લીમીટેક, એ–વિંગ, સ્પર્મો માળ, મેરેશોબ સ્યુચર, મસતલાલ મિલ કંપાઉન્ડ્સ, એન એમ. જેથી માર્ગ લોઅર પરેલ (પૂર્વ), મુંબર્લ-૪૦૦૧૩ ને કરવી અથવા helpdesk.evoting@cdslindia.com પર ઇ–મેઇલ મોકલો અથવ કોન નં. ૦૨૨–૨૩૦૫૮૫૪૨/૪૩ ઉપર વાત કરી શકાશે.

એસ્ટોન પેપર એન્ડ બોર્ડ મીલ લિમીટેડ વર્ત

તારીખ: સપ્ટેમ્બર ૦૫, ૨૦૨૩

હिना शेनठ पटेल

🧶 આહાસોલર ટેક્નોલોજીસ લિમિટેડ CIN: U74999GJ2017PL0

રછ. સરનામું: ચોલિય નંબર 207, બીજો માળ, કલાસાળર શોપિય હબ, સાંઈબાબા મંદિર સામે

स्ताधार क्षेत्र चे. बाटबेध्यि, भगधागाः - 380 061, युश्चात्, भारत क्षेत्र 079-40394029 | 6-मेब्र: complianca@ahasolarin; | वेश्वर्यक्र www.ahasolarin छट्टी वाचिङ सामान्य सरमा राजे धै-वोङ्गिनी महितीनी सूराना

સૂવના આવી આપવામાં આવે છે કે કંપનીની છ**કી** વાર્ષિક સામાન્ય સભા (ABM) શુક્રવાર

સાથે તાંચો 12, 2020, 15 જન્યુઆરી, 2021, 08 પ્રિસેમ્બર, 2021, 13 મે, 2022 અને 05 જન્યુઆરી, 2023.
05 જન્યુઆરી, 2023.
એપની અમિનિસ્થય, 2013 ની કલાય 108 પુજબ કંપનીઝ ભેનેજબેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન્ડ) નિયાયો, 2014 ના નિયાય 20 અને સેબી (100R) રેળ્યુલેશન્સ, 2015 ના નિયાય 44 અને સામાન્ય સભાઓ પર સેક્ટેટીઅલ સ્થાન્ડ (1652) સાથે લાંચી, ઈન્સ્ટિટ્સુટ ઓફ કંપની સેક્ટેસ્ટીઝ એક ઉલ્લેગ કર્યા અર્થાય કરનો સિંગ કર્યા કરવા માર્ચ અર્થાય અર્થ સ્થોયોન સેક્ટ્રિયા ક્રિસ્ટ્રીટ કર્યા પ્રદાન કરવામાં આવેલ ઈનેક્ટ્રીએન્ડ નેશિયા ક્રિસ્ટ્રીટ કર્યા કરવામાં આવેલ ઈનેક્ટ્રીએન્ડ નેશિયા કર્યા પર તેમાનો મત આપના માટે સુધિયા પૂરી પાડનામાં આવે છે. સભ્યોના મતાલન અધિકારો શુન્નાર, 16ની સપ્ટેમ્બર, 2023 (૧૯૨૦) ના એલ ઇન્ડ સ્થાયોના મતાલના નિયાય કર્યા પર તેમાનો મતાલના કર્યા સુધિયા પૂરી પાડનામાં આવે છે. સભ્યોના મતાલના અર્થિયા કર્યા કર્યા કર્યા પર સુધ્યા કર્યા કર

મુક લેધા સ્વાની અનિકિ 10ની સપ્ટેલ્લર, 2023ના રોજ શરૂ શકે અને 22ની સપ્ટેલ્લર, 2023ના રોજ સમાપ્ત શકે (બંને કિવસો સહિત); રિપોર્ટ ઈ-વોર્ટિંગ પંતાનવાર, 19ની સપ્ટેલ્લર, 2023ના રોજ સવારે 08:00 વાળ્યે (8T) શકુ શકે અને યુરુવાર, 21ની સપ્ટેલ્લર, 2023ના રોજ સાર્ચ 06:00 વાળ્યે (8T) સમાપ્ત થકો:

ર. ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કર-એફ તારીખ **શુ**કવાર, 16મી સપ્ટેમ્બર 2023 B:

સભ્યોને ઉપરોક્ત ઉલ્લેમિત સમયગાળા પછી દુરસ્ય ઈન્વોટિવ ક્ષસ મતદાન કરવાની

VCONM કરા સારા રહી શકે છે પરંતુ તેઓ આતા કરાવે પર ફરીથી તેમનો ખત

લોડેં M/s. મુકેશ એવ. શાહ એન્ડ કું., કંપની સેક્રેટરીઓ સ્કૂટિનાઈઝર તરીકે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકારાથી કરવા માટે નિમર્શ્વક કરવામાં આવ્યા છે., જેઓ વોટિંગના પરિશ્વામો અધ્યક્ષને સમિટ કરશે:

અભ્યાસન્ય સમાગન કરવા. એ શેરેલાઇફી ઈનોટિંગ અંગે કોઈ પ્રશ્નો હોય, તો તેઓ મદદ દિભાગ ઢેઠળ www.ending.ned.com પર ઉપલબ્ધ વાર્ડવાર પૂછતા પ્રશ્નો (FACs) અને ઈનોટિંગ મેન્યુઅલનો સંદર્ભે લઈ શકે છે અથવા ઈન્મેલ પોકલી શકે છે. ending@med.co.in ku 1800-222-990 પર સંપર્ક કરો.

u&v: 0x/06/2023

સ્થળ: અમદાવાદ

બોર્ડ ઓફ ડિરેક્ટરના આદેશથી આહાસોલર ટેક્નોલોક્ટર શિમિટેડ માટે, શ્રી પિયુષ ભક્ષ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર DIN: 06461593

Bank

@SETCO

રજીસ્ટર્ડ ઓફિસ્ટ ઇસ્ટોકા-લેક્સ હક્ષ્મ્પે, કેવીલ (પંચમકાલ), મિન કોક - ૩૮૦ ૩૩૦, ગુજરાત, ભારત ૦૦ ૭ ફેક્સ: ૦૨૪૦૬-૨૪૫૨૪ ૭ કે-મેલ: investor.relations@setcosuto.com ૭ વેલસાઇટ: wv

४०भी वार्षिङ सामान्य सला અने ઈ-वोटिंगनी माहितीनी सूचना

સેટલો ઓટોમોટિવ લિમિટેક ("ર્લપની") ની ૪૦ મી વાર્ષિક સામાન્ય સભા ("AGM") બૂધવાર, ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૧:૦૦ વાગ્યે (IST) ની રજીસ્ટર્ડ ઓફિસ ખાતે યોભશે. બરોકા- ગોધરા ક્ષાયે, ક્લોલ (પંચમહલ), પિન કોક – ૩૮૯ ૩૩૦, ગૂજરાત, ભારત ખાતેની કંપની રોમવાર, ૧૪ મી ઓગસ્ટ, ૨૦૨૩, ના રોજની AGM બોલાવતી નોટિસમાં નિર્દ્ધારિત વ્યવસાયના વ્યવહાર કરવા માટે.

ઉપરોક્ત MCA પરિપત્રો અને પરિપત્ર નગર SEBIHO/CFD/POD-2/P/CIR2023/4 તારીખ પમી જાન્યુઆરી, ૧૦૨૩ના પાલનમાં SEBIHO/CFD/CMD2/CIR/P/2023/4 તારીખ પમી જાન્યુઆરી, ૧૦૨૩ના પાલનમાં SEBIHO/CFD/CMD2/CIR/P/2023/11 તારીખ ૧૫મી જાન્યુઆરી, ૧૦૨૩ના પાલનમાં ૧૦૨૬ ક્લાઇન ૧૦૧૬ કલાઇન ૧૦૧૬ ક્લાઇન ૧૦૧૬ કલાઇન ૧૦૧૬ કલાઇન

રોળીના નિયમન ૪૨ (શિટિર્ટેંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્લાચરમેન્ટ્સ) રેગ્યુવેશન્સ, ૨૦૧૫ ("**શેળી લિચિં**ગ **રેગ્યુલે** ૨૦૧૫") ની જેગવાઇઓને અનુસરીને, સભ્યોનું રિજિસ્ટર અને કંપનીના શેર ટ્રાન્સફર બુક કરશે. ગુરુવાર, ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૨ ગુદ્રવાર, ૨૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ (બંને દિવસ સહિત) કંપનીની એસ્ક્લોમના હેતુ માટે બંધ રહેશે.

ું તુવાના કું તે તેમાં તુવાના કું વિકાસ વાર્ટિયા આ તુવાર કંપનીઝ (મેનેજમેન્ટ સોન્ડ એકમિનિસ્ટ્રેશન) નિરામો, ૨૦૧૪ અને સેળી લિસ્ટિંગ ટેએ્યુલેશના, ૨૦૧૫ ની જનારલ મીઠિંગ અને દેગ્યુલેશન જર પર સેફેટરીઅલ સ્ટાન્ડર્ડ--ર સાથે વાંચવામાં આવે છે, જેમ કે સમાચાંતરે સુધારો કરવામાં આવ્યો છે, કંપની બુધવાર, ૨૦ મી સપ્ટેંગર, ૨૦૧૩ ના રોજ કટ-ઓફ તારીખ હોતાથી શેર કારાવતા તેના સભ્યોને એક્ઝેએમની સુચાનામાં દર્શાવેલ તમામ દરકાવે પર મત આપવાના તેમના અધિકારનો ઉપયોગ કરવાનો સુચિતા પૂર્વે પાડવી. સ્થવો ઇન્વોટિંગ સિસ્ટમ (''ક્રિકોક કન્વોહિંગ') નો ઉપયોગ કરીને તેમનો મત આપી શકે છે. કંપનીએ રિગોટ ઇન્વોડિંગ સુચિતા પૂર્વે પાડવી સપ્યો . ઈ–વોર્ટિંગ માટેની વિગતવાર પ્રક્રિયા/સૂચનો ૪૦ મી એજીએમની સૂચનામાં સમાચેલ છે.

આ સંદર્ભે સભાસદોને વધુમાં જણાવવામાં આવે છે કે: (a) કંપનીએ સોમવાર, ૪ થી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ વાર્ષિક અહેવાલ ૨૦૨૨–૨૩ની સાથે ૪૦ મી એજીએમમાં નોટિસ મોકલવ

મથી રિમોટ ઇ-વોર્ટિંગ રવિવાર, જમી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૯:૦૦ વાગ્યે (IST)થી શરૂ થશે અને મંગળવાર, ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યે (IST) સમાદ્ય થશે. કલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા રિમોટ ઇ-વોર્ટિંગને મંગળવાર, રદ્દ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ વાગ્યા (IST) થી વધુ સમયની મંજૂરી આપવામાં આવશે નહીં.

(c) ઇ-વોટિંગના હેતુ માટે કટ-ઓફ તારીખ બૂધવાર, ૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ રહેશે.

(d) કોઈપણ વ્યક્તિ જે કંપનીના શેર મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને છે અને કર-ઓફ તારીખે શેર ધરાવે છે, તે આના પર વિનંતી મોકલીને રિમોટ ઈ-વોર્ટિંગ માટે લોગિન આઈડી અને પાસવર્ડ મેળવી શકે છે. helpdesk.evoting@cdsiindia.com અથવા ટેલિફોન નંબર પર સંપર્છ કરી શકે છે. ૦૨૨–૨૩૦૫૮૬૨૨ જે વ્યક્તિ કટ-ઓફ તારીખે સભ્ય નથી તેથે એજીએમની સૂચનાને માત્ર માહિતીના હૈત માટે જ ગણવી જોઈએ.

હશે. બેલેટ પેપર હારા;

बे सल्योना धंभेस એડ्रेस र्डपनी/आरटीએ/डीपीभी नॉधायेसा नबी तेचा सल्योना धंभेस એડ्रेसनी नॉधशीनी रीत એડ્રિએમ न

ઇ–વૉરિટેંગ સિસ્ટરમમાંથી એસુએમ અને ઇ–વૉરિટેંગમાં હાજરી આપવા સંબંધિત કોઇ પ્રશ્નો અલવા સમસ્યાઓના કિસ્સામાં, તમે મદદ લિભાગ હેઠળ અલવા www.wotingindia.com પર ઉપલબ્ધ વારંવાર પૂછાતા પ્રશ્નો ("FACs") અને ઇ–વૉરિંગ મેન્યૂઅલનો સંદર્ભ વર્ષ શકો nipdoek.voting@odelindia.com પર ઇમેઇલ લખો અલવા શ્રી નોતિન કુંદર (૦૨૨- ૨૩૦૫૮૭૩૮) અથવા શ્રી ભાવેશ પ્રિમ્યૂટકર (૦૨૨–૨૩૦૫૮૫૩૩) અલવા શ્રી ટાકેષા દળવી (૦૨૨–૨૩૦૫૮૫૪૩) નો સંપર્ક કરો.

-વોર્ટિંગ પ્રક્રિયાને લગતી કોઇ વધુ લવેરી અથવા ફરિયાદોના કિસ્સામાં, શેરધારકો રોકાસકાર. relations@selcoauto.co બીને કંપની સેકેટરી શ્રી હિરેન પી. વાળાનો સંપર્ક કરી શકે છે . અલવા ટેલિફોન નંબર પર સંપર્ક કરી શકે છે. ૦૨૨ – ૪૦૭૫૫૫૫

બોર્ડ ઓફ ક્રિકેક્ટર્સના આદેશથં સેટકો ઓટોમોહિવ લિમિટેક માટે

ढिरेल पी. वाल

रुंपनीना सविव

તારી**ખઃ પમી સપ્ટેમ્બર, ૨૦**૨૩

Bandhan | Bandhan Bank Limited | CIN: L67190WB2014PLC204622

Registered Office: DN 32, SEC-V, Salt Lake City, Kolkata-700091

કિમાન્ડ નોટિસ

સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ

સિ<mark>न्युरिटी ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ (એક્ટ)ના સિન્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ફુલ્સ, ૨૦૦૨ (ફુલ્સ)ના નિયમ ૩ સાથૈ વાંચતાં નીચે હસ્તાકાર કરનાર કે જે એક્ટ ફેકળ બંધન બેંક લિમિટેકના અધિકૃત અધિકારી છે અને રૂલ્સના નિયમ ૩ સાથે કલમ ૧૩ (૨) અંતર્ગત મળેલી સત્તાનો ઉપયોગ કરવાને અધિકારી છે, આથી</mark> ઉધારકતા(ઓ)/ગેરન્ટર(રો)/મોર્ટગેજર(રો)(બધા જ એક વચનમાં અથવા સહુંને એક સાથે "બંધનકર્તા"તરીકે ઉલ્લેખવામાં આવે છે તે)/કાયદાકીય વારસદર(રો)/કાયદાકીય પ્રતિનિધિ(ઓ) કે જેમની યાદી અર્દી નીચે આપવામાં આવી છે, તેમને જણાવે છે કે સંબંધિત કિમાન્ડ નોરિસ(સો)માં જણાવવામાં આવેલી રકમ કે જેની વિગતો નીચે આપવામાં આવી છે તે. સંબંધિત નોરિસ(સો)ની તારીખણી ૬૦ દિવસની અંદર ભરપાઇ કરી દે. કથિત નોટિસોની નકલો સ્પીડ પોસ્ટ ક્ષરા મોકલવામાં આવી છે અને નીચે સફી કરનાર પાસે ઉપલબ્ધ છે, અને કથિત ઓબ્લિગેટર(રો)/કાયદાકીય વારસદાર(રો)/કાયદાકીય પ્રતિનિધિ(ઓ), જો તેઓ તેમ કરવા ઇચ્છે તો, નીચે સહી કરનાર પાસેથી, સામાન્ય કામકાજી કલાકો દરમ્યાન, સંબંધિત નકલ મેળવી શકે છે.

ઉપર જણાવાયાના સંબંધમાં, આ સાથે કથિત એબ્લિગેટર(રો)/કાયદાકીય વારસદાર(રો)/કાયદાકીય પ્રતિનિધિ(ઓ)ને, કરી એક વખત નોટિસ આપવામાં આવે છે કે, બંધન બેંક લિમિટેકને, સંબંધિત નોટિસ(સો)ની તારીખથી ક0 દિવસની અંદર, નીચે જણાવાયેલી રકમ કે જેની સામે જે—તે વ્યક્તિઓના નામ જણાવવામાં આવ્યા છે, તે રકમ અને તેની સાથૈ વધુનું વ્યાજ કે જેની વિગત કોલમ (કી)માં જણાવાયેલી તારીખથી લઇને ભરપાઇ કરવાની તારીખ અને/અથવા રિઅલાઇઝેશનની તારીખ સુધી થાય તે, કે જેને લોન કરારની સાથૈ અને અન્ય દસ્તાવેજો/લખાણો, જો કોઇ ક્રેય તો, ની સાથૈ વાંચર્તા, કથિત ઓબ્લિગેટર(શે) ક્ષારા જે એક્ઝિક્યુટ કરાઇ (લેવામાં આવી) છે. લોન ભરપાઇ કરવા માટે , કથિત ઓર્બ્લિગેટર(રો) દ્વારા, નીચે જણાવાયેલી સિક્યોર્ડ સંપત્તિ(ઓ) બંધન બેંક લિમિટેડ પાસે જમીનગીરી તરીકરાખવામાં આવી છે.

લોન ખાતાં નં.	એબ્લિગેટર(રો)/ કાષદાકીય વારસદાર(રો)/કાયદાકીય પ્રતિનિધિ(એ)નાં નામ	નીથે જણાવાચેલી તારીખે કુલ બાકી લેણી રકમ (રૂા.)*	કિમાન્ક નોટિસની તારીખ	એનપીએની તારીખ	સિક્યોર્ડ મિલકતો /અથલ સંપત્તિઓ /મોર્ટગેજ કરાવેલી સંપત્તિઓ
ક્ટર્સ ૧૦૦૦,૦૦૦,૮૦ ર કાર્યશીલ મૂકી સુવિદ્યા (વર્કિંગ કેપિટલ કેસિલિટી)	જ ૪૪, રોજ વૈભવ, પ્રધુમન ગ્રીન સિટી, કાલાવક રોક, રાજકોટ, 35000૧ એ એહીં પણ— તે. જે કે ટ્રેક્સે (ઉધારકર્તા) ડી— 303 રેન્બો સિટી—ર, માસૂમ સ્કૂલ પારો, કાલાવક રોક, મુકામ મોટા ત્રૈવા, જિલ્લો રાજકોટ, ગુજરાત—35000૫ ર. શ્રી શહેન્વર વિમલ બિપિનભાઇ (માલિક, ગેરન્ટર અને મોર્ટગેજર), રાજ વૈભવ, ક્લેટ–૪૦૪, કાલાવક રોક, પ્રધુમન ગ્રીન સિટી, રાજકોટ, ગુજરાત—35000૧ ૩. શ્રીમતી જુલીબેન વિમલભાઇ શહેન્વર (ગેરન્ટર) રાજ વૈભવ, ક્લેટ–૪૦૪, કાલાવક રોક, પ્રધુમન ગ્રીન સિટી, રાજકોટ, ગુજરાત—35000૧ ૪. શ્રીમતી શહેન્વર જયશ્રીબેન બિપિનભાઇ (ગેરન્ટર અને મોર્ટગેજર), જ્વાનાથ એપાર્ટમેન્ટ, બ્લોક છ 3જો માળ, શેરી ૧૩/૭, જંક્શન પ્લોટ, રાજકોટ ગુજરાત 35000૧	রার্থনি জ্যানহের ৭४,২০২ওলা ইাপ্ব হা. ১হ, ४০, ২৬৪.০০	ઓગસ્ટ ૧૯, ૧૦૧૩	উটিল ४, ২০২3	થલ અને અથલ સંપતિનું વર્દાન ૧. ઉદારકર્તાની કંપનીની તમામ ચાલુ મિલકતો કે જેમાં સ્ટોક અને તેવી અન્ય ચલ બુક કેટ્સ, બિલ પછી તે કોક્યુએન્ટરી ત્રોચ અથવા કલીન કાલનાં અ ભવિષ્યનાં નહાંની સમાવેશ શાય છે— તેના પર કાઇપોરિક્ષેશન ક્ર્મ એક્સકલુંસિવ ચાર્જે ૨. વાણિશ્રિક્ષક ઓફિસની તમામ અચલ સંપત્તિ જે બિલ્ડિંગ નં. એ ના ૩જા માળ પ આવેલી નં.૪—એ છે અને જેનો કાપેટ એરિઆ ૪૦—૮૦ ચો. મીટર છે અને તે સાથે અવિભાજિત જમીન વિસ્તાર કે જેનો માપ ૮—૦૦ ચો. મીટર છે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ પોર્ટ કે એન્યુ જેને જે એન.એ. જમીન કે જેનો માપ ૧૦૦૫—૦૦ ચો. મીટર છે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને માપ / પર કે અને જે દેવન્યુ સર્વે નં. પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પપ ને માપ / પર કે માં છે અને જે દેવન્યુ સર્વે નં. પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પાર્ટ કે અને જે દેવન્યુ સર્વે નં. પાર્ટ કે અને જે કે કે હતા કે જે હતા કે

*તે સાથે વધુ વ્યાજ, ખાસ કરીને ઉપર જણાવાચેલી તારીખની કિમાન્ડ નોટિસમાં જે દર જણાવાચો હોય તે દરે વધારાનું વ્યાજ, આકસ્મિક ખર્ચાઓ, કિંમતો, દરો વગેરે જે કંઇ ભરપાઈ કરવાની તારીખ અને/અથવા રિઅલાઇએશનની તારીખ સુધી કરવામાં આવ્યા હોય તે તમામની સાથે. જો કથિત ઓબ્લિગેટર(રો), બંધન બેંક લિમિટેડને, ઉપર જણાવાયા મુજબની ભરપાઈ કરવામાં નિષ્ઠળ જશે તો, બંધન બેંક લિમિટેડ ઉક્ત એક્ટની લમ ૧૩(૪) અને લાગુ પડતા નિયમો અંતર્ગત, ઉપરોક્ત સિક્ચોર્ડ મિલકત(તો)ની સામે, કથિત ઓબ્લિગેટર(રો)/કાયદાકીય વારસદાર(રો)/કાયદાકીય પ્રતિનિધિ(ઓ)ના જોખમે કાર્યવાદી કરશે અને તે અંગેનો ખર તથા પરિણામ તેમાંગે ભોગવવાનાં રહેશે

ઉકત એક્ટ અંતર્ગત. કથિત ઓબ્લિગેટર(રો)/કાયદાકીય વારસદાર(રો)/કાયદાકીય પ્રતિબિધિ(ઓ) પર પ્રતિબંધ છે કે તેઓ બંધબ બેંક લિમિટેકની અગાઉથી લેખિત મંજરી મેળવ્યા વિના. ઉપરોક્ત સિક્યોર્ડ મિલકત(તો)/અચર્લ સંપત્તિઓ વેચાણ, લીસ અથવા અન્યથા ફરતાંતર (ટ્રાંસફર) કરી શક્યે નહીં. કોઇ પણ વ્યક્તિ જે ઉક્ત એક્ટઅથવા નિયમોની જોગવાઇઓનું ઉલ્લંઘન કરે અથવા તો ઉલ્લંઘન કરવામાં મદદ કરે તે તે, ઉક્ત એક્ટમાં જણાવાયા મુજબ કેદ અને /અથવા દંડને પાત્ર ગણાશે.

બંધન બેંક લિમિટેડ વતીર્થ તારીખ : સપ્ટેમ્બર ૦૫, ૨૦૨૩ સ્થળ : રાજકોટ, ગુજરાત અધિકત અધિકારી